



RAN-2001130704010001

M. A. (Sem. - IV) Examination October - 2025
Economics - Theories of International Trade

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન નં. 1 ફરજિયાત છે.
All questions are compulsory
- (3) પ્રત્યેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવ્યા છે.
Figures of the right indicate full marks of question

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.

(10)

1. રીબ્રીન્સકી પ્રમેયનું હાર્દ જણાવો.
2. અસરકારક જકાત દરનું સૂત્ર આપો.
3. TRIPS અને TRIMS નું પુરું નામ જણાવો.
4. જકાતસંઘને અસર કરતાં પરિબળો જણાવો.
5. “જે (J)” વક્રનો ખ્યાલ આપો.

પ્ર. 2. વૈકલ્પિક ખર્ચ એટલે શું? હેબરલરનો સ્થિર, વધતાં અને ઘટતાં વૈકલ્પિક ખર્ચની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિધ્ધાંત સમજાવો.

(13)

અથવા

પ્ર. 2. અનુકુળ અને પ્રતિકુળ વેપારની શરત એટલે શું? વેપારની શરતોના પ્રકારો અને મર્યાદાઓની વિગતે ચર્ચા કરો.

(13)

પ્ર. 3. અ. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)

(07)

બ. પ્રાદેશિક આર્થિક સહકારનું સ્વરૂપ

(06)

અથવા

પ્ર. 3. અવમૂલ્યનની વ્યાખ્યા આપી. અસમતુલા દુર કરવાના ઉપાય તરીકે અવમૂલ્યના ખ્યાલની ટીકાત્મક ચર્ચા કરો.

(13)

પ્ર. 4. નીચેનામાંથી કોઈપણ બે ટૂંકનોંધ લખો.

(14)

1. સાધનભાવ સમાનતા પ્રમેયનું મૂલ્યાંકન
2. પ્રેબિશ - સિંગર પરિકલ્પના.
3. આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહ.
4. માર્શલ-લર્નર શરત.

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions in brief: (10)**
1. State the Gist of Rybczynskis Theorem.
 2. Give the formula of Effective Rate of Tariff.
 3. State the full form of TRIPS and TRIMS.
 4. State the Factors affecting to Customs Union.
 5. Give the Concept of 'J' curve.
- Q. 2. What is Opportunity Cost? Explain Haberler's theory of international trade under the condition of Constant, Increasing and Decreasing opportunity Cost. (13)**
- OR**
- Q. 2. What is Favorable and Unfavorable Terms of Trade? Discuss in detail the types and limitations of terms of trade. (13)**
- Q. 3. A. World Trade Organization (WTO). (07)**
B. Forms of Regional Economic Cooperation. (06)
- OR**
- Q. 3. Give the definition of Devolution. Critically discuss the concept of Devaluation as a remedy for disequilibrium. (13)**
- Q. 4. Write any Two short notes: (14)**
1. Evaluate the Factor Price Equalization Theorem.
 2. Prebisch-Singer Hypothesis.
 3. International Capital Flow.
 4. Marshall-Lerner Condition.
-